તા. ૨૫/૩/૨૦૦૩ મંગળવાર

શ્રી ઇમામશાહ બાવા રોઝા સંસ્થા ટ્રસ્ટ પીરાણાની કારોબારીની મીટીંગ તા. ૨૫/૩/૨૦૦૩ ને મંગળવાર ના રોજ બપોરે ૩-૦૦ કલાકે મીટીંગ હોલમાં મળી જેમાં નીચેના ટ્રસ્ટીઓએ હાજરી આપી.

(૧) આચાર્યશ્રી નાનકાકા ગુરુ કરસનકાકા ચેરમેન
(૨) ટ્રસ્ટીશ્રી સોમજીભાઈ કરસનભાઈ પટેલ
(૩) " રતિભાઈ જેઠાભાઈ પટેલ
(૪) " દેવરામભાઈ દેવશીભાઈ પટેલ
(૫) " કુંવરજીભાઈ રામજીભાઈ પટેલ
(૬) " ઇશ્વરભાઈ ભાઈલાલભાઈ પટેલ
(૭) " માવજીભાઈ ડાહ્યાભાઈ ધોળુ (પટેલ)
(૮) " ફકરુદ્દીન જડામીયા સૈયદ
(૯) " ઈજાઝઅલી જલાલમીયા સૈયદ
(૧૦) " સરદારઅલી અબ્બાસઅલી સૈયદ
(૧૧) " કેશાભાઈ ભવાનભાઈ પટેલ (સંમતિપત્રક)

ઉપર મુજબના ૧ થી ૧૦ ટ્રસ્ટીઓ મીટીંગમાં હાજર રહી આજની મીટીંગ કોરમ થવાથી આજની સભાનુ કામકાજ નીચે મુજબ શરૂ કરવામાં આવે છે. અનુક્રમ નં (૧૧) સંમતિપત્રક આપેલ છે

ઠરાવનં-૧ ગત સભાનુ પ્રોસીડીંગ વંચાણલેવા બાબત. → ગત સભાનુ પ્રોસીડીંગ વંચાણમાં લેવા બાબત શ્રી ઇમામશાહ બાવા રોઝા સંસ્થા કમિટી પીરાણાની તા. ૭/૨/૦૩ના રોજ મળેલ કારોબારીની મીટીંગમાં થયેલ કાર્યવાહીની નોંધ વંચાણમાં લેવામાં આવી જેને બહાલી આપવામાં આવી. ઠરાવની તરફેણ કરનાર સભ્ય ૧ થી ૭ તથા વિરોધ કરનાર ૮ થી ૧૦ સભ્યો છે. ઠરાવ પસાર કરવામાં આવે છે.

ઠરાવનં-૨ → સંસ્થાની મુલાકાતે આવતા દર્શનાર્થીઓ તથા અન્ય નાગરીકો સંસ્થાની મિલકત જેવી કે સમાધિસ્થાન રોજા દરગાહ બાબા દેવસ્થાન-[illegible] કે બીજી મિલકતોની વીડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરી તેનો દુરઉપયોગ કરે છે અને સંસ્થા વિરુદ્ધ તેનો ઉપયોગ કરી સંસ્થાને નુકશાન કરે છે તેથી સંસ્થાના સમાધિસ્થાન રોજા સંકુલ કે [illegible] દેવસ્થાનની કે કોઈ મિલકતની કોઈએ વીડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવા મનાઈ કરવાનો ઠરાવ કરવામાં આવે છે.